

સરકારી કચેરીઓ માટે ખાનગી વાહન ભાડે
રાખવાની મંજૂરી બાબત.

ગુજરાત સરકાર

નાણા વિભાગ

પરિપત્ર ક્ર: પરચ/૧૦૨૦૧૪/૧૮૦૦/ઝ.૧

સચિવાલય, ગાંધીનગર,

તા.૨૦/૦૬/૨૦૨૨

વંચાણે લીધા:-

(૧) સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ ક્ર: મકમ/૨૦૦૪/૨૫૩૯(૨)/ખ.૩, તા.૦૧/૦૪/૨૦૧૦

(૨) નાણા વિભાગનો પરિપત્ર ક્ર: પરચ/૧૦૨૦૧૪/૧૮૦૦/ઝ.૧, તા.૨૨/૦૫/૨૦૧૫

(૩) નાણા વિભાગનો ઠરાવ ક્ર: મસભ/૧૦૨૦૧૨/૭૬૧/ચ, તા.૨૨/૦૩/૨૦૨૨

પરીપત્ર:-

સચિવાલયના વહીવટી વિભાગો, રાજ્ય સરકાર હસ્તકની ખાતાના વડાની કચેરીઓ તથા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં આઉટસોર્સિંગ એજન્સી મારફત વાહન સુવિધા અને વાહન હંકારનારની સેવાઓ મેળવવા બાબતે જરૂરી સૂચનાઓ સામાન્ય વહીવટ વિભાગના વંચાણે લીધા ક્રમ (૧)માં દર્શાવેલ ઠરાવથી બહાર પાડવામાં આવેલ છે. જેના અનુધાને નાણા વિભાગના વંચાણે લીધા ક્રમ (૨)માં દર્શાવેલ પરીપત્રથી માસિક રૂ.૫૦૦ કિ.મી. ની મર્યાદામાં પ્રતિ કિ.મી. રૂ.૮(આઠ)ના દરે પેટ્રોલ/ડીઝલ/સીએનજી સંચાલિત વાહન ભાડે રાખવાની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારની હાલની સૂચનાઓ મુજબ ભાડેથી વાહન મેળવવા ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઈ પેટ્રોલ, ડીઝલ તેમજ સીએનજીના વધતાં જતા ભાવોને ધ્યાને લઈને પુખ્ત વિચારણાને અંતે જે સરકારી કચેરીઓને વાહન ભાડે રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે તે કચેરીઓને નીચે મુજબની માસિક કિ.મી.ની મર્યાદામાં પ્રતિ કિ.મી. રૂ. ૧૧.૦૦(અગિયાર)ના દરે પેટ્રોલ/ડીઝલ/સીએનજી સંચાલિત વાહન ભાડે રાખવા મંજૂરી આપવામાં આવે છે.

ક્રમ	કચેરી	કિ.મી. (મર્યાદા)	રીમાર્ક્સ
૧	રાજ્ય કક્ષાની કચેરીઓ /જોનલ કચેરીઓ	૩૦૦૦ કિ.મી.	
૨	જિલ્લા કક્ષાની કચેરીઓ	૨૫૦૦ કિ.મી.	બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે સામેના કોલમમાં સૂચવેલ કિ.મી.(મર્યાદા) માં ૨૫% સુધીનો વધારો કરી શકશે.
૩	તાલુકા કક્ષાની કચેરીઓ	૨૦૦૦ કિ.મી.	

દરેક કચેરીઓએ સીએનજી વાહન ભાડે રાખવાને અગ્રિમતા આપવાની રહેશે. આ સૂચનાઓનું દરેક કચેરીઓએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(કોમલ ભટ્ટ)

નાયબ સચિવ (કરકસર)

નાણા વિભાગ.